



BBL-007-1016009

Seat No. _____

B. Sc. (Sem. VI) (CBCS) (W.E.F.-2016) Examination

July - 2021

Home Science : P-02

(Research & Documentation)

(New Course)

Faculty Code : 007

Subject Code : 1016009

Time : 2 Hours]

[Total Marks : 50

સૂચના : (1) નીચેના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબ લખો.
(2) બધા જ પ્રશ્નોના સમાન ગુણ ધરાવે છે.

- | | | |
|----|--|----|
| 1 | સંશોધનનો અર્થ અને હોમ સાયન્સમાં સંશોધનનો ફાળો ચર્ચો. | 10 |
| 2 | સંશોધન પદ્ધતિના તબક્કાઓ સમજાવો. | 10 |
| 3 | સર્વેક્ષણ પદ્ધતિ વિશે સમજાવો. | 10 |
| 4 | પ્રશ્નાવલી પદ્ધતિ વિશે ચર્ચા કરો. | 10 |
| 5 | ઉપકલ્પના વિશે માહિતી આપો. | 10 |
| 6 | આલેખ દ્વારા માહિતીની રજૂઆત વર્ણવો. | 10 |
| 7 | સંશોધનની લાક્ષણિકતાઓ અને હેતુઓ સમજાવો. | 10 |
| 8 | કોષ્ટકીકરણ દાખલા આપી સમજાવો. | 10 |
| 9 | મુલાકાત પ્રક્રિયા સવિસ્તર સમજાવો. | 10 |
| 10 | સંશોધન સમસ્યાની પસંદગી ચર્ચો. | 10 |

ENGLISH VERSION

Instructions : (1) Write any five answer from the following questions.

(2) All questions carry equal marks.

- | | | |
|----|--|----|
| 1 | Meaning of research and role of research in Home Science. Discuss. | 10 |
| 2 | Explain steps of Research Method. | 10 |
| 3 | Explain about Survey Method. | 10 |
| 4 | Discuss about questionnaire method. | 10 |
| 5 | Give information about Hypothesis. | 10 |
| 6 | Describe the presentation of data by graph. | 10 |
| 7 | Explain characteristics and objectives of research. | 10 |
| 8 | Explain tabulation with example. | 10 |
| 9 | Explain in detail interview method. | 10 |
| 10 | Selection of research problem – discuss. | 10 |
-